

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટનમાં સાત નવી આઉટડોર પિકલબૉલ કોર્ટ્સ ખુલ્લી મૂકવામાં આવી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 27, 2019) – પિકલબૉલ એ કેનેડામાં સૌથી ઝડપથી વિકસી રહેલી રમતો પૈકી એક છે, અને આ રમત હવે બ્રેમ્પટનમાં પોતાનું ઘર ધરાવે છે! સીટી ઓફ બ્રેમ્પટનને સાર્વજનિક વપરાશ માટે બે સ્થળોએ સાત આઉટડોર પિકલબૉલ કોર્ટ્સ ઔપચારિક રીતે ખુલ્લી મૂકી છે.

1. ફ્લાવર સીટી કમ્યુનિટી કેમ્પસ | 8950 મેક્લોક્લિન રોડ

સોમવારથી શુક્રવાર, સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી, સીટી કર્મચારીગણ લેકોસ બોક્સમાં ચાર પિકલબૉલ કોર્ટ્સની ગોઠવણ કરશે. આ સિવાયના સમયે, ખેલાડીઓ પોતાની પોર્ટેબલ નેટ્સ લાવી શકે છે અને વહેલા તે પહેલા (ફર્ટ-કમ, ફર્ટ-સર્વ) ધોરણે રમી શકે છે.

2. સેન્ટેનિઅલ પાર્ક | 53 સેન્ટર સ્ટ્રીટ સાઉથ

ટેનિસ સીઝન દરમિયાન (મે મહિનાથી ઓક્ટોબર સુધી) ત્રણ કોર્ટ્સ ઉપલબ્ધ રહે છે, જે વહેલા તે પહેલા (ફર્ટ-કમ, ફર્ટ-સર્વ) ધોરણે કાર્યરત રહે છે. ખેલાડીઓને વ્યસ્ત સમય દરમિયાન દર અડધા કલાકે કોર્ટ્સ ફેરવી નાખવાનું (રોટેટ કરવાનું) કહેવામાં આવે છે જેથી દરેક વ્યક્તિને રમવાની તક મળવાની ખાતરી કરી શકાય.

સીટી ઓફ બ્રેમ્પટનને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ રિક્રિએશન સેન્ટર્સમાં ઈનડોર ડ્રોપ-ઇન પિકલબૉલ રમાડવાની તૈયારી પણ બતાવી છે. ડ્રોપ-ઇન (ગમે તે સમયે ચાલ્યા આવવાના) સમયો અને સ્થળો ઓનલાઇન [ડ્રોપ-ઇન ક્લિટર](#) મારફતે ઉપલબ્ધ છે.

એક હરિયાળા શહેર (ગ્રીન સીટી) તરીકે, અમે રહેવાસીઓને શક્ય હોય ત્યારે બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. તમારો રૂટ (માર્ગ) શોધી કાઢવા વેબસાઇટ www.bramptontransit.com જુઓ.

અવતરણ (ક્વોટ):

“બ્રેમ્પટનમાં વૈવિધ્યસભર સમુદાય રહે છે જે રમતોમાં ઉત્સાહી લોકોથી ભરપૂર છે, અને હું દરેક વ્યક્તિ માટે ઉપયોગમાં લેવા આપણી નવી પિકલબૉલ કોર્ટ્સે જરૂર કરવામાં રોમાંચ અનુભવું છું. આ હજુ પણ બીજી એક રીત છે જેનાથી આપણે આપણાં શહેરને આરોગ્યપ્રદ અને સુરક્ષિત રાખી રહ્યા છીએ અને ખાતરી કરીએ છીએ કે શહેરવાસીઓ પાસે આઉટડોર્સમાં રમવાની અને આનંદ લેવાની તક રહે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca